

# થોર્નાઇટનો જોડાણવાએ

## અથવા

# પ્રયત્ન અને બૂલ હારા શિક્ષણ

# થોર્નાઇક




- એડવક થોર્નાઇક - અમેરિકા
- 1874 – 1949
- કોલંબિયા યુનિ.માં અદ્યાપક
- બિલાડી પર પ્રયોગ
- માણલી, વાંદરા, બિલાડી પર પણ પ્રયોગો

# થોર્નટાઇક




# Thorndike Puzzle Box



# સાધન રચના


## Thorndike Puzzle Box



- સમર્કયા પેટીમાં ભૂખી બિલાડી
- પેટીની બછાર – બિલાડી જોઈ શકે તેમ માંસ (ખોરાક) મૂક્યો
- પેટીના તળીયે કળ
- કળ દ્વારા વાચણું ખૂલે

# પ્રયોગ શીત


**Thorndike Puzzle Box**



- બિલાડીના આંદળુકીયા પ્રથળો
- અચ્ચાનક પગ કળ પર પડયો
- બારણું ખૂલ્યું
- બિલાડી બહાર આવી ખોરાક મેળવ્યો
- પ્રયોગનું પુનરાવર્તન
- દર વખતનો સમય નોંધયો
- કમશા: સમય ઓછો
- સૌથી પહેલાં ૧૫૦ સેકન્ડ ૨૪ મા પ્રથળે ૧૦ સેકન્ડ

# • પ્રયત્ન અને ભૂલ દ્વારા અદ્યાયનના લક્ષણો

- શીખનાર સામે કોઇ પ્રેરણ (બિલાડી ભૂખી)
- શીખનાર સમજ કોઇ ઓક્કેક્સ ધ્યેય (ખોરાક)
- અનેક પ્રતિચાર
- ચોગ્ય પ્રતિચારની પસંદગી
- પ્રતિચાર સંતોષપ્રદ અને અસંતોષપ્રદ
- પ્રયત્નોની સંખ્યા વધે તેમ અસંતોષપ્રદ ઘટે અને સંતોષપ્રદ વધે
- પ્રયત્ન એટલે લાગેલો સમય અથવા થયેલ ભૂલોની સંખ્યા
- પ્રાણી સાચા પ્રતિચાર સંગ્રહે અને ખોટા ભૂલે
- પ્રાણી શીખી રહણું છે તેની પ્રતિતિ લાગતા સમય કે ભૂલોની સંખ્યાને આધારે



# ଓଡାନ୍ତରଣୀ

•କ୍ଷେତ୍ରିକ ପ୍ରେଟିଙ୍ଗ

•ଜୋଡ଼ଣ୍ଡି

•ଶୂନ୍ୟ

•କ୍ଷମିତ

•ତରତାଂ

•ଲଖତାଂ

•ଵିଵିଧ କୌଶଳ୍ୟୋ

# અદ્યાયના નિયમો

- અસરનો નિયમ
- પુનરાવર્તન(મહાવરા)નો નિયમ
- તરપકતાનો નિયમ

# અસરનો નિયમ

- જ્યારે ઉદ્દીપક અને પ્રતિચાર વચ્ચે જોડાણ થાય ત્યારે કે ત્યાર પણી સંતોષજનક અનુભૂતિ થાય તો જોડાણ મજબૂત બને છે અને જો અસંતોષજનક અનુભૂતિ થાય તો તે જોડાણ નબળું પડે છે.
- સંતોષ એટલે એવી અનુભૂતિ કે જે દૂર કરવા પ્રાણી કોઈ પ્રયત્ન ન કરે, અસંતોષ એટલે જેને ટકાવી રાખવા કોઈ પ્રયત્ન ન કરે
- આપણો સંતોષપ્રદ અનુભવ ચાદ રાખીએ છીએ, અસંતોષજનક ભૂલી જઇએ છીએ.

# શૈક્ષણિક ફલિતાર્થ

- વિદ્યાર્થી પ્રશંસા યોગ્ય કામ કરે ત્યારે બદલો આપવાથી તેને સંતોષ થાય છે. આથી તે ફરી જ્ઞાનું કામ કરે છે.
- વર્ગમાં ખોટો જવાબ આપનારને ઉતારી પાડવાથી તેને દુઃખ થાય છે. પરિણામે તે જવાબ આપવા અટકાય છે.

# પુનરાવર્તનનો નિયમ

- બે પેટા નિયમ : (૧) ઉપયોગનો નિયમ (૨) અનુપયોગનો નિયમ
- ઉપયોગનો નિયમ: ઉદ્દીપક-પ્રતિચારના જોડાણાનું પુનરાવર્તન કરવામાં આવે તો તેનાથી ઉ-પ્ર જોડાણની મજબૂતાઈ વધે છે.
- જોડાણની મજબૂતાઈ વખતે વિદ્યાર્થીના રક્ષા, થાક, સમય વગેરે એકસરખા માનવામાં આવેલ છે.

# અનુપયોગનો નિયમ

૩- પ્ર વચ્ચે જોડાણ થયા બાદ જો લાંબા સમય સુધી ફરી આ જોડાણ ના થાય તો જોડાણની મજબૂતાઇ ઘટે છે.

E.I.T.

- રૂપેલિંગ / જોડણી
- હાર્મોનિયમ
- વિદ્યાર્થીઓના નામ
- ટેલિફોન નંબર
- કવિતા / ગીત

# શૈક્ષણિક ફલિતાર્થ

- વિદ્યાર્થી પાસે મહાવરો/પુનરાવર્તન કરાવતું
- વિદ્યાર્થીઓને રૂવાણ્યાય આપવા
- પુનરાવર્તનની સાથે બદલો/વખાણ આપવા
- આંકના ઘડીયા, ફિલિ, વગેરે

# તત्पृतानो नियम

- જ્યાં સુધી બાળક શીખવા માટે તત્પર ન હોય ત્યારે તેને શીખવવાની કોશીશ કરવી વ્યર્� છે.
- શિક્ષકનું કાર્ય બાળકને શીખવા માટે તત્પર કરવાનું છે.
- તત્પૃતા એટલે માનવિક તૈયારી, નહીં કે પરિપક્વતા

# નિયમ

- જ્યારે વહન એકમ વહન કરવા તરપર હોય ત્યારે વહન કરતું સંતોષપ્રદ બને છે.
- જ્યારે વહન એકમ વહન કરવા તૈયાર ન હોય ...ત્યારે...
- જ્યારે વહન એકમ વહન કરવા તૈયાર હોય અને વહન ન કરતું તે દુઃખ દાયક/અસંતોષપ્રદ બને છે.
- વર્ક્ષાદ પડતો હોય અને ઉનાળાની બપોરનો નિંઘ શીખવવો...
- માધ્યમિકશાળામાં જાતીય શિક્ષણ ન આપતું
- નવરાત્રીમાં રાત્રે વાંચવા બેઝવાળું કહેતું

# શૈક્ષણિક ફલિતાર્થ

- શીખવતા પઠેલાં વિષયાભિમુખ કરાવવું
- અમુક પરિપક્વતા આવ્યા પછી જ અમુક વિષયવર્ણતું શીખવવું
- જાતીય શિક્ષણ માદ્યમિકક્ષાએ આપવું
- અભ્યાસકક્ષમનું આયોજન શાળા અને પાઠ્યપુસ્તકમંડળે વાતાવરણ, ઉમર, જાતિ વગેરેને ધ્યાનમાં રાખી કરવું